SEA [A	TNo SARDAR PATEL UNIVERSITY Diploma in Taxation Laws & Practice Examination	:5
(n	J _J Saturday, 8 th , April, 2017 10.00 Å.M – 01.00 P.M.	
	DTP – 103: Principles of Accountancy and Service Tax- Paper III Total Mar	ks: 70
Note:	Figures to the right indicate full marks.	· · .
Q.1	 Pass the necessary Journal entries for the following transaction of Shri. Patel. 1. Started Business with ₹.4,00,000 in the Bank and ₹.80,000 cash. 2. Bought shop fittings ₹.80,000 and a van ₹.1,20,000.Both paid by cheque 3. Paid rent by cheque ₹.10,000. 	[15]
	 Bought goods for resale of ₹. 1,00,000 on credit from Vir and Co. Cash sales ₹.10,000. 	
	 Paid wages of assistants in cash ₹.2,000. Paid insurance premium by cheque ₹.1,000. 	
1.4	 Cash sales ₹.16,000. Purchase goods of ₹.5000 at 10% trade discount and 5% cash discount from M/s Shah. 	om
	10. Goods returned to Vir & Co. ₹.12,000. 11. Paid Vir & Co. ₹.60,000 by cheque.	
	12. Bought goods for resale on credit from M/s.Padma Traders ₹.50,000. 13. Cash Sales ₹.14,000.	
	14. Bought Stationery, paid in cash ₹.1,000. 15. Deposited in Bank ₹.10,000.	
	$\mathbf{O}_{\mathbf{A}} = \left\{ \begin{array}{ll} \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \begin{array}{ll} \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} \\ \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} \\ \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} \\ \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} \\ \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} \\ \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} \\ \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} \\ \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} \\ \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} \\ \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} & \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{\mathbf{A}} \right\} \\ \mathbf{O}_{\mathbf{A}} = \left\{ \mathbf{O}_{A$	
Q.1 a) b)	What is account? Explain the functions and objectives of accounting? Who are the users of accounting information in business? Explain the limitations accounting.	[08] of [07]
Q.2	Post the journalized transaction of Shri Patel into appropriate ledger. OR	[15]
Q.2	Write notes on: 1. Difference between Trail Balance and Balance sheet 2. Accounting Principles 3. Revenue Expenditure and Capital Expenditure	[15]
Q.3	The accountants of M/s. Mahavir Trading wrongly prepare the following Balance. You are required to draw up a Trial Balance correctly stating the record	Trial

•

.

2.3 The accountants of M/s. Mahavir Trading wrongly prepare the following Trial Balance. You are required to draw up a Trial Balance correctly stating the reasons in brief: [10]

Sr.No.	Heads of Accounts	Debit Balance ₹.	Credit Balance ₹.
1	Capital		1,20,000
2	Stock (Opening)	10,000	.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
3	Discount Received		1,000
4	Commission Received		1,400
5	Fixed Assets		1 20 000
6	Sales	1,70,000	1,20,000
7	Purchases		90,000
8	Return Out ward	·····	2,000
9	Return inward	4,000	2,000
10	Carriage Inward		1,200

.

		3,55,000	3,55,000
20	Closing Stock	67,600	
19	Creditors	13,800	
18	Cash	1,600	
17	Interest Paid		4,000
16	Rent	6,000	
15	Bills Payable		14,000
14	Debtors	18,000	
13	Bills Receivable	14,000	
12	Wages and Salary	50,000	1,100
11	Carriage out ward		1,400

OR

Q.3 a) Write on advantages of Journal.

b) Explain the rules of debit and credit with example. [05] [05]

From the following trial Balance prepare a Trading and Profit and loss account for the Q.4 year ending 31st December, 2016 and a Balance sheet as on that date: [10]

Heads of Accounts	Amount ₹.	Heads of Accounts	Amount₹.
Sundry Debtors	15,000	Rent, Rates and Taxes	8,000
Stock 1 st January,2016	50,000	Salaries	20,000
Land & Building	1,00,000	Drawings	
Cash in Hand	16,000	Purchases	20,000
Cash at Bank	40,000	Office Expenses	1,00,000
Wages	30,000	Plant and Machinery	25,000
Bills Receivable	20,000	Capital	57,000
Interest Paid	2,000	Interest Received	2,50,000
Bad Debts	5,000	Sundry creditors	6,000
Repairs	3,000		70,000
Furniture and Fixtures		Sales	1,70,000
	15,000	Bills Payable	40,000
Depreciation	10,000		

On 31st December, 2016 the stock was valued at ₹.1,00,000 OR.

Q.4

Explain types of errors in trial balance. [10] What is service Tax? Explain the history and constitutional authority under service tax Q.5 in India. [10] OR Q.5 Write on: [10] 1. Sports services exempted from service tax 2. Copy right services exempted from service tax What is the meaning of Services as per Section 65B (44)? Explain the charge of Q.6 service tax with reference to Section 66B. [10] OR Explain abatement in respect of different taxable services under Service tax act in Q.6 brief. [10] (2)

SARDAR PATEL UNIVERSITY Diploma in Taxation Laws & Practice Examination Saturday, 8th, April, 2017 10.00 A.M - 01.00 P.M. DTP - 103: Principles of Accountancy and Service Tax- Paper III

Total Marks: 90

(१५)

નોંધ: જમણી બાજુના આંકડા ગુણભાર દર્શાવે છે.

શ્રી પટેલના ચોપડે નીચેના વ્યવહારો પરથી જરૂરી આમનોંધ લખો. પ્ર.૧

૧. બેન્ક સિલક રૂ.૪,૦૦,૦૦૦ અને રૂ.૮૦,૦૦૦ રોકડા સાથે ધંધો (કારોબાર) શરૂ કર્યો.

૨.૬કાનનું ફર્નિચર રૂ.૮૦,૦૦૦ મા અને વાન રૂ.૧,૨૦,૦૦૦ મા ખરીદી બંનેની ચૂકવણી ચેકથી કરી. 3. રૂ.૧૦,000 ભાડું ચેકથી ચુકવ્યું.

૪.વીર ઍન્ડ કું માથી પુન વેંચાણ માટે રૂ.૧,00,000 ની માલ શાખપર ખરીદી કરી.

પ. રોકડ વેચાણ રૂ .૧૦,૦૦૦.

૬. મદદનીશને રૂ.૧૦,૦૦૦ મજુરી રોકડેથી ચુકવી.

૭.રૂ.૧૦૦૦ ચેકથી ચૂકવેલ વીમા પ્રિમીયમ.

- ૮. રોકડ વેચાણ રૂ.૧૦,000.
- ૯. મેસર્સ શાહ પાસેથી રૂ.૫,૦૦૦ નો માલ ૧૦% વેપારી વટાવ અને ૫% રોકડ વટાવે ખરીદયો.
- ૧૦. વીર એન્ડ કું ને રૂ.૧૨,૦૦૦ નો માલ પરત કર્યો.

૧૧. વીર એન્ડ કું ને રૂ.૬૦,૦૦૦ ચેકથી ચૂકવ્યા.

૧૨. મેસર્સ પદમાપાસેથી રૂ.૫૦,૦૦૦ના માલની ખરીદી કરી.

૧૩. રોકડવેચાણરૂ.૧૨,000.

૧૪. સ્ટેશનરીની ખરીદી, રોકડમાંરૂ.૧,000 ચૂકવણી કરી.

૧૫. બેન્કમાં રૂ .૧૦,૦૦૦ જમા કરાવ્યા.

અથવા

પ્ર.૧ અ) નામું એટલે શું? નામાના કાર્યો અને ઉદ્દેશ્યો સમજાવો? (00) બ) ધંધામાં હિસાબી માહિતીના વપરાશકર્તાઓ કોણ છે? નામાની મર્ચાદાઓ સમજાવો. (0૭) શ્રી પટેલ ના ચૉપડે આમનોંધ પરથી વિવિધ ખાતાવફી તૈયાર કરો. ЯS (૧૫)

અથવા

નોંધો લખો: น. २

> (१५) ૧. કાચા સરવૈયા અને પાકા સરવૈયા વચ્ચે તફાવત

ર. નામાના સિદ્ધાંતો

(PTV)

૩. મેફ્સુલી-ખર્ચ અને મુડી ખર્ચ

પ્ર.૩

મેસર્સ મહાવીર ટ્રેડિંગ ના મુનીમે કાચું સરવૈચું ખોટું બનાવ્યું છે. તમારે સાચું કાચું સરવૈયું બનાવી તેના ટુંકમાં કારણ આપવાના છે. (૧૦)

ક્રમ	ખાતાં	ઉધાર બાકી	જમા બાકી
٩	મુડી		٩,२0,000
5	સ્ટોક (ઉઘડતો)	٩0,000	· · · · · · · · · · · · · · · · · · ·
3	મેળવેલ વટાવ		٩,000
8	મેળવેલ કમિશન		٩,४00
ų	સ્થાયી મિલકતો		٩,२0,000
S	વેચાણ	٩,७0,000	
٩	ખરીદી		60,000
د	ખરીદ પરત		٤,000
e	વેચાણ પરત	۷,000	
٩0	આવક માલ ગાડા ભાડું		٩,२००
૧૧	જાવક માલ ગાડા ભાડું	TRPH	٩,४00
૧૨	મજુરી અને પગાર	40,000	
٩3	લેણી કુંડી	٩४,000	
१४	દેવાદારો	٩८,000	
૧૫	દેવી કુંડી		٩४,000
१५	ભાડું	\$,000	
૧૭	ચુકવેલ વ્યાજ		۷,000
१८	રોકડ	٩,۶00	
٩૯	લેણદારો	93,600	
50	આખર સ્ટોક	\$ 9,\$00	
-		3,44,000	3,44,000

અથવા

પ્ર.૩ અ) આમ નોંધના ફાયદા પર લખો.

બ) ઉધાર અને જમાના નિયમો ઉદાહરણ સાથે સમજાવો.

(04)

(५)

(૦૫)

પ્ર.૪ નીચેના કાચા સરવૈયા પરથી વર્ષ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ ના અંત નુ વેપાર ખાતુ, નફા અને નુકસાન ખાતું અને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ ના રોજ પાકું સરવૈયું તૈયાર કરો: (૧૦)

ખાતા	રક્રમ	ખાતા	
દેવાદારો			રક્રમ
	૧૫,000	ભાડુ અને કરવેરા	600, ک
સ્ટોક ૧ જાન્યુઆરી, ૨૦૧૬	40,000	પગાર	20,000
જમીન અને મકાન	٩,00,000	ઉપાડ	20,000
હાથ પર રોકડ	٩ \$,000	ખરીદી	٩,00,000
બેંકમાં રોકડ	¥0,000	અન્ય ખર્ચા	૨૫,000
મજુરી	30,000	પ્લાન્ટ અને યંત્રો	ય૭,000
લેણી હુંડી	20,000	મુડી	२,५०,०००
ચુકવેલ વ્યાજ	२,000	મેળવેલ વ્યાજ	5,000
ઘાલખાધ	૫,000	લેણદારો	30,000
મરામત	3,000	વેચાણ	٩,७0,000
ફર્નિચર અને ફિક્ચર	૧૫,000	દેવી હુંડી	80,000
ધસારો	٩0,000	3	
0.00			

૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ ના રોજ સ્ટોકની કિંમત ૧,૦૦,૦૦૦ હતી.

અથવા

કાચા સરવૈયાની ભૂલોના પ્રકારો સમજાવો. እ.እ

પ્ર.૫ સર્વિસ ટેક્સ શું છે? ભારતમાં સેવા વેરા ઇતિહ્રાસ અને સેવા વેરા હેઠળની બંધારણીય સત્તા સમજાવો. (૧૦)

અથવા

પ્ર.૫ નોંધ લખો:

અ) રમતગમત સેવાઓનીસેવા કર મુક્તિ

બ) કૉપિ રાઇટ સેવાઓની સેવાકર મુક્તિ

પ્ર.૬ વિભાગ ૬૫ બ (૪૪) તરીકે સેવાઓનો અર્થ શું છે? વિભાગ ૬૬ બ ના સંદર્ભમા સર્વિસ ટેક્સ ચાર્જ સમજાવો. (૧૦)

અથવા

પ્ર.૬ સેવા કર અધિનિયમ હેઠળ વિવિધ કરપાત્ર સેવાઓની સંદર્ભમાં ઘટાડો સંક્ષિપ્તમાં સમજાવો.

(10)

——X — (5) (૧૦)

(10)

an Angele and a stand of the stand The stand of the stan The stand of the stand

A- Non appealable order 12 B- Deference of retail invoice and tax invoice 12 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 OR 0R 11				
(127) DIPLOMA IN TAXATION LAWS AND PRACTICE EXAMINATION 2017 2017 FRIDA '07''' APRIL 10-00 A.M. TO 01-00 P. M. GUJARAT VALUE ADDED TAX AND CENTERAL SALES TAX LAWS (PAPER-II) OUTAL MARKS: 70 NOTE - FIGURES TO THE RIGHT INDICATE FULL MARKS Q-1 Examine the meaning of Value Added Tax and discuss the types of 'goods' under the Value Added Tax Act 0R Q-1 State and discuss the authorities and their powers under the Value Added Tax Act. 12 Q-2 How many kinds of returns under the Value Added Tax? Discuss each in detail. 11 Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 Q-4 Explain in detail provision regarding registration of a dealer under the Value Added Tax Act. 11 Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 A- Special mode of recovery of tax 12 B- Audit assessment 0R C- Order of rectification of mistake 12 D- Offences and penalties 12 Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added Tax Act. 11 Q-4 Discuss fully the provisions of appeal under the Value Added Tax Act. 11		SEAT No.	NO OF PRINTED PAGES-02	
FRIDAY 07 ^M - APRIL 10-00 A.M. TO 01-00 P.M. GUJARAT VALUE ADDED TAX AND CENTERAL SALES TAX LAWS (PAPER-II) TOTAL MARKS: 70 NOTE - FIGURES TO THE RIGHT INDICATE FULL MARKS Q-1 Examine the meaning of Value Added Tax and discuss the types of 'goods' under the Value Added Tax Act 12 Q-1 Examine the meaning of Value Added Tax and discuss the types of 'goods' under the Value Added Tax Act 12 Q-1 Examine the meaning of Value Added Tax and discuss the Value Added Tax Act. 12 Q-2 Explain the term sunder the Value Added Tax? Discuss each in detail. 11 Q-2 Explain in detail provision regarding registration of a dealer under the Value Added Tax Act. 11 Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 A- Special mode of recovery of tax B- Audit assessment C- 12 Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added 12 Q-4 Discuss under the Value Added Tax Act. 12 A- Non appealable order 12 B- Deference of retail invoice and tax invoice 11 Q-5 Discuss fully the provisions of appeal under the Value Added Tax Act. 11 Q-6		[n 2 +] DIPLOMA IN TAXATION LAWS AND PRACTI	CE EXAMINATION	
POTE - FIGURES TO THE RIGHT INDICATE FULL MARKS 12 Q-1 Examine the meaning of Value Added Tax and discuss the types of 'goods' under the Value Added Tax Act. 12 Q-1 State and discuss the authorities and their powers under the Value Added Tax Act. 12 Q-2 How many kinds of returns under the Value Added Tax? Discuss each in detail. 11 Q-2 Explain in detail provision regarding registration of a dealer under the Value Added Tax Act. 11 Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 A - Special mode of recovery of tax B - Audit assessment 12 C - Order of rectification of mistake D - Offences and penalties 12 Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added Tax Act. 12 Q-4 Discuss under the Value Added Tax Act 12 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 <td></td> <td>FRIDAY 07TH -APRIL 10-00 A.M.TO 01-00 P.M. GUJARAT VALUE ADDED TAX AND CENTERAI</td> <td>· · · · · · · · · · · · · · · · · · ·</td> <td></td>		FRIDAY 07 TH -APRIL 10-00 A.M.TO 01-00 P.M. GUJARAT VALUE ADDED TAX AND CENTERAI	· · · · · · · · · · · · · · · · · · ·	
Q-1 Examine the meaning of Value Added Tax and discuss the types of 'goods' under the Value Added Tax Act 12 Added Tax Act OR 12 Q-1 State and discuss the authorities and their powers under the Value Added Tax Act. 12 Q-2 How many kinds of returns under the Value Added Tax? Discuss each in detail. 11 Q-2 Explain in detail provision regarding registration of a dealer under the Value Added Tax Act. 11 Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 A Special mode of recovery of tax 14 B Audit assessment 12 C Ord of rectification of mistake 12 D Offences and penalties 12 Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added 12 R-4 Discuss under the Value Added Tax Act. 12 B- Deference of retail invoice and tax invoice 12 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 A Interstate trade B Importance of form-'E-1' 12 <td></td> <td></td> <td>TOTAL MARKS: 70</td> <td></td>			TOTAL MARKS: 70	
OR 0R Q-1 State and discuss the authorities and their powers under the Value Added Tax Act. 12 Q-2 How many kinds of returns under the Value Added Tax? Discuss each in detail. 11 Q-2 Explain in detail provision regarding registration of a dealer under the Value Added Tax Act. 11 Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 A Special mode of recovery of tax 12 B Audit assessment 12 C Order of rectification of mistake 12 D Offences and penalties 12 Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added 12 Tax Act. OR 12 Q-4 Discuss under the Value Added Tax Act 12 A Non appealable order 12 B Deference of retail invoice and tax invoice 12 Q-5 Discuss fully the provisions of appeal under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 A Interstate trade 1 1 B Importance of form-'F' 1		NOTE - HOOKES TO THE RIGHT INDICATE FULL MARKS		
Q-1 State and discuss the authorities and their powers under the Value Added Tax Act. 12 Q-2 How many kinds of returns under the Value Added Tax? Discuss each in detail. 11 Q-2 Explain in detail provision regarding registration of a dealer under the Value Added Tax Act. 11 Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 A- Special mode of recovery of tax 12 B- Audit assessment 12 C- Order of rectification of mistake 12 D- Offences and penalties 12 Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added 12 R-4 Discuss under the Value Added Tax Act 12 A- Non appealable order 12 B- Deference of retail invoice and tax invoice 12 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 A- Interstate trade 11 B- Importance of form-'E-1' 11 C- Importance of form-'E-1' 11	Q -1	Examine the meaning of Value Added Tax and discuss the ty Added Tax Act	pes of 'goods' under the Value	12
Q-2 How many kinds of returns under the Value Added Tax? Discuss each in detail. 11 OR OR Q-2 Explain in detail provision regarding registration of a dealer under the Value Added Tax Act. 11 Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 A Special mode of recovery of tax 12 B Audit assessment 12 C Order of rectification of mistake 12 D Offences and penalties 12 Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added 12 Tax Act. OR 12 Q-4 Discuss under the Value Added Tax Act 12 A Non appealable order 12 B Deference of retail invoice and tax invoice 12 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Importance of form 'E-1' 14 + + + + + + + + + + + + + + + + + + +				
Q-2 How many kinds of returns under the Value Added Tax? Discuss each in detail. 11 OR OR Q-2 Explain in detail provision regarding registration of a dealer under the Value Added Tax Act. 11 Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 A Special mode of recovery of tax 12 B Audit assessment 12 C Order of rectification of mistake 12 D Offences and penalties 12 Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added 12 Tax Act. OR 12 Q-4 Discuss under the Value Added Tax Act 12 A Non appealable order 12 B Deference of retail invoice and tax invoice 12 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Importance of form 'E-1' 14 + + + + + + + + + + + + + + + + + + +	Q-1	State and discuss the authorities and their powers under the	e Value Added Tax Act.	12
Q-2 Explain in detail provision regarding registration of a dealer under the Value Added Tax Act. 11 Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 A- Special mode of recovery of tax 12 B- Audit assessment 12 C- Order of rectification of mistake 12 D- Offences and penalties 12 Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added 12 Tax Act. OR 12 Q-4 Discuss under the Value Added Tax Act 12 A- Non appealable order 12 B- Deference of retail invoice and tax invoice 12 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Importance of form-'E-1' 14 C- Importance of form-'F* 14 D- Importance of form-'C' 14 E- Dealer 14	Q-2	How many kinds of returns under the Value Added Tax? Dis	cuss each in detail.	11
Q-3 Write short notes under the Value Added Tax Act (Any Two) 12 A - Special mode of recovery of tax B - Audit assessment 12 C - Order of rectification of mistake D - Offences and penalties 12 Q-4 Explain the term 'business', 'sales price' , 'purchase price' and 'refund' under the Value Added 12 Q-4 Discuss under the Value Added Tax Act 12 Q-4 Discuss under the Value Added Tax Act 12 Q-4 Discuss under the Value Added Tax Act 12 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 Q-5 Discuss fully the provisions of appeal under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Importance of form-'E-1' 12 Q-6 Importance of form-'E-1' 14 Q-6 Importance of form-'E-1' 14 Q-7 Importance of form-'C' 14 Q-8 Importance of form-'C' 14	0.0	OR		
 A- Special mode of recovery of tax B- Audit assessment C- Order of rectification of mistake D- Offences and penalties Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added 12 Tax Act. OR Q-4 Discuss under the Value Added Tax Act A- Non appealable order B- Deference of retail invoice and tax invoice Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. Q-5 Discuss fully the provisions of appeal under the Value Added Tax Act. Q-6 Write any two short notes under the C.S.T.Act. A- Interstate trade B- Importance of form-'E-1' C- Importance of form-'F' D- Importance of form-'C' E- Dealer 	-	Explain in detail provision regarding registration of a dealer	under the Value Added Tax Act.	11
Q-4 Explain the term 'business', 'sales price', 'purchase price' and 'refund' under the Value Added 12 Tax Act OR 12 Q-4 Discuss under the Value Added Tax Act 12 A- Non appealable order 12 B- Deference of retail invoice and tax invoice 12 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 OR OR Q-5 Discuss fully the provisions of appeal under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 A- Interstate trade B- Importance of form-'E-1' 1407 C- Importance of form-'F' D- Importance of form-'C' 14 E- Dealer (P+to) (P+to)	Q-3	 A- Special mode of recovery of tax B- Audit assessment C- Order of rectification of mistake 		12
 Q-4 Discuss under the Value Added Tax Act A- Non appealable order B- Deference of retail invoice and tax invoice Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 OR Q-5 Discuss fully the provisions of appeal under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 A- Interstate trade B- Importance of form-'E-1' C- Importance of form-'F' D- Importance of form-'C' E- Dealer 	Q-4	Explain the term 'business', 'sales price' , 'purchase price' and	'refund' under the Value Added	12
A- Non appealable order 12 A- Non appealable order 12 B- Deference of retail invoice and tax invoice 11 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 OR 0R Q-5 Discuss fully the provisions of appeal under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 A- Interstate trade 11 12 B- Importance of form-'E-1' 12 C- Importance of form-'F' 12 D- Importance of form-'C' 12 E- Dealer 12		OR		
 Q-5 What is lump sum tax? Who can opt for lump sum tax? Explain under the Value Added Tax Act. 11 Q-5 Discuss fully the provisions of appeal under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 Q-6 Interstate trade B- Importance of form-'E-1' C- Importance of form-'F' D- Importance of form- 'C' E- Dealer 	Q-4	A- Non appealable order		12
Q-5 Discuss fully the provisions of appeal under the Value Added Tax Act. 11 Q-6 Write any two short notes under the C.S.T.Act. 12 A- Interstate trade B- Importance of form-'E-1' C- Importance of form-'F' D- Importance of form- 'C' E- Dealer	Q-5	What is lump sum tax? Who can opt for lump sum tax? Explai	n under the Velue Added Thur A	
Q-6 Write any two short notes under the C.S.T.Act. 11 A- Interstate trade B- Importance of form-'E-1' C- Importance of form-'F' D- Importance of form- 'C' E- Dealer			n under the value Added Tax Act.	11
A- Interstate trade B- Importance of form-'E-1' C- Importance of form-'F' D- Importance of form- 'C' E- Dealer	Q-5	Discuss fully the provisions of appeal under the Value Added	Tax Act.	11
C- Importance of form-'F' D- Importance of form- 'C' E- Dealer	Q-6	A- Interstate trade		12
D- Importance of form- 'C'			- 	
E- Dealer		C- Importance of form-'F'		
			(P.TO))

ગુજરાતી તરજુમો

પ્રશ્ન-૧	મુલ્ય વર્ધિત કરના કાયદા હેઠળ મુલ્ય વર્ધિત કરનો અર્થ અને માલના પ્રકારો ચર્ચો.	૧૨
	અથવા	
પ્રશ્ન-૧	મુલ્ય વર્ધિત કરના કાયદા ઠેઠળ મુલ્ય વર્ધિત સત્તાધીશો દર્શાવો અને તેમની સત્તાઓ ચર્ચો.	٩૨
પ્રશ્ન-૨	મુલ્ય વર્ધિત કરના કાયદા ઠેઠળ પત્રકોના કેટલા પ્રકારછે? દરેકની વિસ્તારથી ચર્ચો કરો.	૧૧
	અથવા	,
પ્રશ્ન-૨	મુલ્ય વર્ધિત કરના કાયદા હેઠળ વેપારીની નોધણી અંગેની જોગવાઈ વિસ્તારથી સમજાવો. 📧	૧૧
પ્રશ્ન-3	મુલ્ય વર્ધિત કરના કાયદા ફેઠળ ટૂંક નોધ લખો (ગમે તે બે)	૧૨
	અ- વેરા વસુલાતની ખાસ રીત	(C
	બ- ઓડીટ આકારણી	
	ક- ભૂલ સુધારણા આદેશ	
	ડ- ગુનાઓ અને સજાઓ	
પ્રક્ષ-૪	મુલ્ય વર્ધિત કરના કાયદા હેઠળ 'ધંધો','વેચાણ કિંમત', ખરીદ કિંમત' અને 'રીફડ' પદ સમજાવો	१२
	અંશવા	
પ્રશ્ન-૪	મુલ્ય વર્ધિત કરના કાયદા ફેઠળ ચર્ચો-	१२
	અ- બિન અપીલ પાત્ર આદેશો	
·	બ- ઇન વોઈસ અને રીટેલ ઇન વોઈસ વચ્ચેનો તજ્ઞવત	
1101 14		
પ્રશ્ન-પ	મુલ્ય વર્ધિત કરના કાયદા ઠેઠળ ઉચ્ચક વેરો એટલે શું છે ?ઉચ્ચક વેરાની ચોજનાનો લાભ કોણ	ঀঀ
	મેળવી શકે ? સમજાવો	
	અથવા	
પ્રક્ષ-પ	મુલ્ય વર્ધિત કરના કાયદા દેઠળ અપીલની જોગવાઈઓ વિસ્તારથી ચર્ચો.	૧૧
પ્રક્ષ-૬	કેન્દ્રીય વેચાણવેરા અધિનિયમ દેઠળ ગમે તે બે ટૂંક નોધ લખો -	૧૨
	અ- આંતર રાજ્ય વેપાર	
	બ- 'ઈ-૧' ફોર્મની અગત્યતા	
	ક- 'એફ' ફોર્મની અગત્યતા	
	ડ- 'સી' ફોર્મની અગત્યતા	
	ઈ- વેપારી	
ۥ ;		

•

(2)

ŞEAT	No	
------	----	--

ł

NO OF PRINTED PAGES-02

SARDAR PATEL UNIVERSITY PLOMA IN TAX LAW AND PRACTICE EXAMINATION 2017 THURSDAY, 0**6**TH -APRIL 10-00 A.M.TO 01-00 P.M. INCOME TAX LAW AND PRACTICE

(PAPER-1)

TOTAL MARKS: 70

NOTE	- FIGURES TO THE RIGHT INDICATE FULL MARKS OF THE QUISTIONS.	•
Q -1	Discuss briefly the incomes that are chargeable to income tax under the head income from salary. OR	11
Q-1	State and explain any ten incomes exempt from tax under Income Tax Act.	11
Q-2	Describe in detail various types of return of income under the Income Tax Act.	12
	OR	
Q-2	Discuss the various residential status under the Income Tax Act.	12
Q-3	What is agriculture income? What incomes are included in agriculture income? Explain how the agriculture income is included for the rate purpose? OR	12
Q-3	What is tax deducted at source? Explain the provisions of T.D.S in Income Tax Act.	12
Q-4	What is assessment? Explain various types of assessment in detail.	11
	OR	
Q-4	Explain the procedure for payment of advance tax and discuss the consequences in default of payment of advance tax.	11
Q-5	 Explain any two in detail:- A- Total Income B- Depreciation C- Deduction from business or profession D- Permanent account number 	12
Q-6	Write any two in detail :- E-Procedure to recovery of Income Tax A-Order of tribunal B-Rectification of mistake C-Capital gain	12
•	(1)	

	ગુજરાતી તરજુમો	
'પ્રશ્ન-૧	પગારના શીર્ષક હેઠળ આવકવેરા પાત્ર આવકની સંક્ષિપ્તમાં ચર્ચા કરો અથવા	૧૧
પ્રશ્ન-૧	ખ્યવ્ય આવકવેરા ધારા હેઠળ ગમે તે દશ આવકો આવકવેરામાંથી મુક્ત રાખેલ છે તે દર્શાવો અને સમજાવો	૧૧
પ્રશ્ન-૨	આવકવેરા ધારા હેઠળ આવકવેરાના વિવિધ પત્રકોનું વર્ણન કરો અથવા	ે ૧૨
પ્રશ્ન-૨	આવકવેરા ધારા હેઠળ રહેઠાણના વિવિધ દરજ્જાઓની ચર્ચા કરો.	૧૨
પ્રશ્ન-૩	ખેતીની આવક એટલે શું ? કઈ કઈ આવકો ખેતીની આવકમાં સમાવેશ થાય છે? ખેતીની આવકનો આવકવેરાનો દર ગણવામાં કેવી રીતે સમાવેશ થાય છે તે સમજાવો	ધર
	અથવા	
પ્રશ્ન-૩	મૂળમાંથી કર કપાત એટલે શું ? મૂળમાંથી કરકપાત અંગેની આવકવેરા ધારાની જોગવાઈઓ સમજાવો	૧૨
પ્રશ્ન-૪	આકારણી એટલે શું ? વિવિધ પ્રકારની આકારણી વિગતવાર સમજાવો	የየ
	અથવા	
પ્રશ્ન-૪	અગ્રીમ કરની ચુકવણી કાર્ય પદ્ધતિ સમજાવો તથા અગ્રીમ કરની ચુકવણીમાં કશુર થયે તેની અસરો ચર્ચો	૧૧
પ્રશ્ન-પ :	ગમે તે બે વિસ્તારથી સમજાવો:- અ- કુલ આવકો બ- ઘસારો ક- ધંધા કે વ્યવસાયમાંથી કપાતો ડ –કાયમી ખાતા નબર	૧૨
પ્રશ્ન-૬	ગમે તે બે વિસ્તારથી લખો :- અ-આવક વેરો વસુલ કરવાની કાર્ય પદ્ધતિ બ- ટ્રીબ્યુનલનો હુકમ ક- ભૂલ સુધારણા ડ- મૂડી નફો -──X ─	૧૨
	(2)	